

એનેક્ષર - એ (A)

(સામાન્ય વહીવટ વિભાગના તા: ૦૧.૦૫.૨૦૦૬ ના પરિપત્ર ક્રમાંક: પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-
આરટીઆઇસેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર
કરવાની બાબતો " પ્રોએક્ટીવ ડિસ્કલોગર " (P.A.D.) મારા વિભાગ દ્વારા તૈયાર કરવામા આવેલ છે અને
તા. ૦૧/૦૫/૨૦૨૪ ની સ્થિતિએ વડી કચેરીની મંજૂરી મેળવી અધતન કરવામાં આવેલ છે.

તારીખ : ૨૫/૦૫/૨૦૨૪

મુખ્ય મથક: નવસારી


(વી. આર. નાયક)

સહ સંશોધન નિયામક

નવસારી કૃષિ યુનિવર્સિટી,

નવસારી.

એનેક્ષર-બી (B)

(સામાન્ય વહીવટ વિભાગના તા, ૦૧.૦૫.૨૦૦૯ ના પરિપત્ર ક્રમાંજ: પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪-
આરટીઆઇસેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે માનનીય સાહેબશ્રી, વડી કચેરી (પ્રોપર) તથા માનનીય
સાહેબશ્રી, વહીવટી કાર્યક્ષેત્ર નાં આ સાથેની યાદી મુજબનાં જાહેર સત્તામંડળો દ્વારા માહિતી અધિકાર
અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો " પ્રોએક્ટીવ ડિસ્કલોઝર " (P.A.D.) તૈયાર
કરવામા આવી છે. અને તા. ૧/૫/૨૦૨૪ ની સ્થિતિએ તે ઈ/ચા. સંશોધન નિયામક અને અનુસ્નાતક
વિદ્યાશાખાધ્યક્ષશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા અધ્યતન કરવામાં આવેલ છે. જેનું અમારા
દ્વારા માહે : મે / જુન ૨૦૨૪ (વર્ષ) દરમ્યાન ઇન્સ્પેક્શન -ક્રમ - ઓડિટ કરવામાં આવ્યું છે અને જ
બાબતે ક્ષતિ જણાઈ હતી અગાર અપુરતી વિગતો જણાઈ હતી તેની પુર્તતા કરવામાં આવી છે.

(૨) તા. ૩૦/૬/૨૦૨૪ (વર્ષ) ની સ્થિતિએ હવે કોઈ જાહેર સત્તામંડળનાં (પ્રોએક્ટીવ ડિસ્કલોઝર)
ઇન્સ્પેક્શન -ક્રમ - ઓડિટ બાકી રહેલ નથી.

તારીખ : ૨૮/૦૬/૨૦૨૪

મુખ્ય મથક: નવસારી

સંશોધન નિયામક અને
અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ,
નવસારી કૃષિ યુનિવર્સિટી,
નવસારી.

સંશોધન નિયામક અને
અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષશ્રીની કચેરી
નવસારી કૃષિ યુનિવર્સિટી
નવસારી

સ્વયંભૂ જાહેર કરાયેલી માહિતી
(પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર) પરિચયગ્રંથ

માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫
પ્રકરણ-૨, કલમ ૪(૧)(ખ)

તા.૦૧/૦૫/૨૪ ની સ્થિતી

મુદા નં :-3

માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળોની જવાબદારીઓ કલમ-૪(૧)ખ
(પ્રો-એક્ટિવ ડીસ્કલોગર)

મુદા નં-૧ :- પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો :-

વ્યવસ્થાતંત્ર	હોદ્દો	કાર્ય અને ફરજોની વિગતો
કચેરીના વડા	સંશોધન નિયામક અને અનુસ્નાતક વિધાશાખાધ્યક્ષ	<p>સ્ટેચ્યુટઈ ૧૧૪ એસ.૪૧.૮ મુજબ નક્કી થયેલ કાર્ય અને ફરજો નિભાવવી</p> <p>➢ સ્ટેચ્યુટમાં દર્શાવેલ નિતિ નિયમોનું પાલન કરવું અને કરાવવું</p> <p>➢ અનુસ્નાતક અભ્યાસક્રમ તથા સંશોધન પ્રવૃત્તિઓનું સંપૂર્ણપણે સંચાલન કરવું.</p>

મુદા નં-૨ :- પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો :-

ડૉ. વી.આર.નાયક, સહ સંશોધન નિયામક (રીસર્ચ)

- દરેક સબ સેન્ટરની સંશોધન યોજનાઓની મોનીટરીંગ અને ઇવેલ્યુએશનની કામગીરી
- યુનિવર્સિટી કક્ષાએ વિવિધ સંશોધન કેન્દ્રો ખાતે જુદા જુદા ઐતી/અન્ય કાર્યો માટે કરવામાં આવતી જાહેર હરાજ અંગેની કામગીરી
- યુનિવર્સિટીકક્ષાએની સીક્યુરીટી કમિટીના મેભર સેકેટરી તરીકેની કામગીરી
- ભારત સરકાર તથા ગુજરાત સરકારના Research ને લગતી તમામ કામગીરી (સંશોધન)
- પ્લાન, નોન પ્લાન, અધર એજન્સી યોજનાઓની સમગ્ર તાંત્રિક કામગીરી તેમજ ગુજરાત સરકારશ્રીને લગતી પત્રવ્યવહારની કામગીરી (ટી.૧, ટી.૨ અને ટી.૫)
- ટી.૧, ટી.૨, ટી.૨ (એ) ટી.૫ ની તમામ ટેકનીકલ અને વહીવટી કામગીરીઓની દેખરેખ અને માર્ગદર્શન.
- યુનિવર્સિટીની સંશોધન યોજનાની ખરીદીની મંજુરીની કામગીરી (એ.૩)
- ઎ડ.એ.આર.સી./એગ્રેડ્યુલિસ્ટ/રીસર્ચ કાઉન્સિલની કામગીરીની સમગ્ર કામગીરીઓનું મોનીટરીંગ.
- કચેરીના વડા તરફથી સોંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી તથા સંશોધન નિયામકશ્રીની ગેરહાજરીમાં કચેરીની સમગ્ર જવાબદારી.
- સરદાર પટેલ એવોર્ડ, આત્મા પ્રોજેક્ટ એવોર્ડ અને A to Z પોર્ટલ નોડલ અધિકારી તરીકેની કામગીરી તથા કૃષિ મહોત્સવ/વિસ્તરણની કામગીરીઓ
- અધર એજન્સી યોજના હેઠળ નવા પ્રોજેક્ટની ચકાસણી અને માર્ગદર્શન (ટી.૧)
- સ્ટેટસીડ સબ કમિટી વેરાયટી નોટીફિકેશન અને PPVFRA અંગે જરૂરી માર્ગદર્શન તથ સરકારશ્રી ધ્વારા આયોજિત મીટિંગમાં ભાગ લેવું તેમજ બીજ ઉત્પાદન અને બિયારણને લગતી સમગ્ર કામગીરીનું મુલ્યાંકન (ટી.૫)
- RTI-PIO તરીકેની સંપૂર્ણ કામગીરીની દેખરેખ (OS ફાઇલ/રજીસ્ટર સંભાળશે)
- ADR (Education) ની ગેરહાજરીમાં કચેરીની સમગ્ર જવાબદારી

ડૉ. લલિત મહાત્મા, સહ સંશોધન નિયામક (એજ્યુકેશન)

- PG ટેબલ અને ICAR ની સમગ્ર કામગીરીની દેખરેખ અને માર્ગદર્શન (ટી.૩ અને ટી.૪)
- ICAR Ranking, GSIRF, NIRF Ranking, ELU Nodal Officer (ટી.૧ અને ટી.૪)
- Right to Citizen to Public Services
- બેસ્ટ રીસર્ચ એવોર્ડની કામગીરી (ટી.૧)

Maile

- ભારત સરકાર તથા ગુજરાત સરકારના PG Education ને લગતી તમામ કામગીરી (શિક્ષણ, વિસ્તરણ)
- અનુસ્નાતક અભ્યાસક્રમને લગતા તમામ પ્રકારની તથા અન્ય શૈક્ષણિક કામગીરીની જવાબદારી
- MoU ની સંકલનની કામગીરી
- P.G. Board of Studies and Board of Studies of all Faculties ની કામગીરી
- Deans Committee /Sport Committee /Academic Council and Board of Management ની કામગીરી
- ICAR(Adhoc), AICRP, ભારત સરકાર/ અન્ય સંસ્થાની યોજનાઓની સમગ્ર કામગીરી
- AEMS Monitoring ની કામગીરી
- ADR (Research) ની ગેરહાજરીમાં કચેરીની સમગ્ર જવાબદારી
- Natural farming ની કામગીરી
- કચેરીના વડા તરફથી સોંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

ડૉ. એ. આર. લાઠિયા આયોજન અધિકારી

- પ્લાનિંગ સેલની સંપૂર્ણ જવાબદારી
- ઉપાડ અને યુક્તવણ્ણ અધિકારી (DDO) તરીકેની કામગીરી
- વિકાસ ખર્ચ (પ્લાન) અંતર્ગત કૃષિ શિક્ષણ, વિસ્તરણ શિક્ષણ અને સંશોધનની ચાલુ યોજના તથા નવી યોજનાઓની દરખાસ્તો યુનિવર્સિટીના વિભાગો/કેન્દ્રો /કચેરીઓ પાસેથી મંગાવવાથી લઇને સરકારશીમાં ૨૪ કરવા સુધીની તમામ કામગીરીનું સંકલન
- યુનિવર્સિટી ખાતે ચાલતી ડેવલોપમેન્ટ ચાર્જિસ (પ્લાન) ની યોજનાઓના ત્રિમાસિક રીવ્યુ અંગેની કામગીરી તથા પત્રવ્યવહારની કામગીરી
- એન્યુઅલ ડેવલોપમેન્ટ પ્લાન (ADP) ની કામગીરી
- પીડીસી માથી ૨૪ કરવાના થતા નવા મુદ્દાઓ અંગે સંચાલક મંડળની બેઠક (BOM) ૨૪ કરવાની કામગીરી
- યુનિવર્સિટીની સ્ટેચ્યુટરી કમિટી (PDC)ના સભ્ય સચિવ તરીકેની કામગીરી
- રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ અને સ્થાયી પરામર્શ સમિતી અંગેની કામગીરી
- પ્લાન યોજનાને લગતા ટેકનીકલ LAQ અંગેની કામગીરી
- વિકાસ ખર્ચ યોજના (પ્લાન) અંતર્ગત પ્રવૃત્તિની રૂપરેખા, કામગીરી અંદાજપત્ર, સિદ્ધિઓ, પ્લાન રીસીપ્ટ, બેલેન્સ બજેટ અંગેની કામગીરી
- એન્યુઅલ પ્લાન, સ્કીમ કન્ટીન્યુએશન ઓર્ડર, ન્યુ સ્કીમ ઇમ્પલીમેન્ટેશન ઓર્ડર, આઇસીએઆર (૨૫ %) બજેટ તેમજ દરેક પ્લાન યોજનાઓનું મહેકમ વિગેરેની કામગીરી
- આયોજન હેઠળની યોજના બજેટ સદર ૧૨૦૬૩ અને ૧૨૦૬૭ પ્રોજેક્ટ ઇન્યાર્જ તરીકેની સંપૂર્ણ જવાબદારી
- ગવર્નમેન્ટ ઇ. માર્કેટપ્લેસ (GEM) ના નોડલ ઓફિસર તરીકેની કામગીરી
- વિકાસ ખર્ચ યોજના (પ્લાન) નવા પ્રોજેક્ટને લગતી કામગીરી
- વિકાસ ખર્ચ યોજના (પ્લાન)ની નવી યોજનાઓની દરખાસ્તો ને સરકારશીમાં ૨૪ કરવાને લગતી કામગીરી
- વિકાસ ખર્ચ યોજના (પ્લાન) બજેટને લગતી કામગીરી
- એન્યુઅલ ડેવલોપમેન્ટ પ્લાન (ADP) તૈયાર કરવાની કામગીરી
- ગુજરાત સરકારશી તેમજ રાજ્ય કૃષિ યુનિવર્સિટી પરિષદ સાથેના વખતોવખતના પત્રવ્યવહારની કામગીરી
- સ્થાયી પરામર્શ સમિતી અંગેની કામગીરી
- PDC/ SAU Council/ સ્થાયી પરામર્શ સમિતી/ BOM અંગેની કામગીરી
- કચેરીના વડા તરફથી સોંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

ટી.૧ ટેબલ ડૉ. જી. ડી. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક

- યુનિવર્સિટીની સીક્યુરિટી કોન્ડ્રાક્ટને લગતી તમામ કામગીરીઓ

- રીસર્ચ કાઉન્સિલમાં રજુ કરવાની થતી મુદ્દાનોધો તૈયાર કરવી ,મીટિંગનું આયોજનની કામગીરી તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના એપ્પુવલ માટે રજુ કરવાની મુદ્દાનોધ અંગેની કામગીરી
- યુનિવર્સિટી કક્ષાએ બેસર રીસર્ચ એવોર્ડ અંગેની કામગીરી
- IBSC, GMO કોપ Biodiversity Board ની તથા પેટર્નને લગતો પત્રવ્યવહાર
- અધર એજન્સી યોજના હેઠળ નવા પ્રોજેક્ટ પ્રોજેક્ટની ચકાસણી અને ફાઇનલ પ્રોજેક્ટ સબમીશનને લગતી સઘળી કામગીરી તથા પત્રવ્યવહાર
- બીટી કોટન/ અન્ય પાકો અને તેને સંલભ પત્રવ્યવહારની કામગીરી
- બાંધકામ સમિતીને લગતી પત્રવ્યવહાર
- સંશોધન કેન્દ્રોના ઉત્પાદનની ઘર માંડવાળ , જનરલ વેચાણ, હરાજુને લગતી તમામ તાંત્રિક મંજુરી
- કચેરીના વડા તરફથી સોંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

ટી.૨ ટેબલ ડૉ. બી.બી..પટેલ, મદદનીશ પ્રાધ્યાપક

- આર.કે.વી.વાય. યોજનાને સંલભ યુનિવર્સિટી કક્ષાએથી પ્રોજેક્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા તેમજ મંજુર થયેલ પ્રોજેક્ટોના માસિક, ત્રિમાસિક અને વાર્ષિકનો પ્રગતિ અહેવાલની કામગીરી
- નેશનલ હોર્ટિકલ્ચર મિશન હેઠળ નવા પ્રોજેક્ટની દરખાસ્ત તૈયાર કરી મંજુર કરાવવા તેમજ તેને લગતી સઘળી કામગીરીઓ કરવી
- યુનિવર્સિટી હસ્તકના દરેક સંશોધન કેન્દ્રોની ફાર્મ ડેવલોપમેન્ટને લગતી ટેકનીકલ કામગીરીઓની મંજુરી
- યુનિવર્સિટીના દરેક ફાર્મોની જમીનને લગતી પ્રશ્નો અને તેનું નિરાકરણ અને ફાર્મ વિકાસની કામગીરી
- ઓર્ગેનિક ફાર્મિંગ, સજીવ ખેતી અને પાકૃતિક ખેતી અંગેની કામગીરી
- કન્ટીજન્સી પ્લાન તૈયાર કરી સરકારશ્રીમાં રજુ કરવાની કામગીરી
- સરકારશ્રીને લગતી તમામ ટેકનીકલ પત્રવ્યવહાર
- યુનિવર્સિટી કક્ષાએ ખેતીને સંલભ ઉચ્ચકદરો તેમજ અન્ય ઉત્પાદકોના ભાવો મંજુર કરવાની કામગીરી
- યુનિવર્સિટી કક્ષાએ રીવોલ્વીંગ ફંડ સદરે મંજુરીઓની કામગીરીઓ
- સંશોધન કેન્દ્રોની પાક યોજનાની મંજુરીની કામગીરી
- સરકારશ્રીને લગતી તમામ ટેકનીકલ પત્રવ્યવહાર
- કચેરીના વડા તરફથી સોંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

ટી.૩ ટેબલ ડૉ. દિનેશ એચ. ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક

- ડીન, પી.જી ટેબલની તમામ કામગીરી તેમજ યુઝુ ને લગતી કામગીરી
- યુનિવર્સિટીના બધા જ એવોર્ડની કામગીરી તથા ગોલ્ડ મેડલ અંગે નિષ્ણાંત વૈજ્ઞાનિકશ્રીઓ કમિટીની રચના
- એકેડ્મીક કાઉન્સિલ PG Board Board of Studies/ Faculty Board અંગે મુદ્દા નોંધ તૈયાર કરવી અને મંજુર કરવાની કામગીરી
- MOU ની કામગીરીનું બધા જ ટેબલથી સંકલન કરવું
- પી.જી. એડમીશનની કામગીરી
- ફોરેન સ્કુલ માટેની કમિટી/ડાંસ કમિટીની કામગીરી
- Board of management ની સઘળી કામગીરી
- Examination Committee ની સઘળી કામગીરી
- P.G. Teacher Recognition P.G. expert list તૈયાર કરવું.
- NAHEP- 2A પ્રોજેક્ટની કામગીરી


સહ સંશોધન નિયામક(રીસર્ચ)

- PG Teaching and Guiding Application, Scrutiny, Meeting, Minutes and Guide Recognition Order
- ASPEE foundation JRF Application, minutes and Fellowship Order
- Foreign students admission
- Modification in students advisory committee/ Synopsis Approval and Modification
- કચેરીના વડા તરફથી સૌંપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

ટી.૪ ટેબલ ડૉ. એમ. એસ. શાંકનુર, મદદનીશ પ્રાધ્યાપક

- Correspondence with ICAR/GoI/GoG/Funding agencies.
- Assisting in review and monitoring of ICAR funded schemes.
- Assisting in ICAR Development grant- Review and monitoring.
- Application of ICAR ranking and its related works
- Assisting in TSP/SCSP proposal submission, monitoring and reporting
- Submission of ICAR- summer/winter schools and short term training
- Demand of ICAR-JRF, ICAR-SRF, NTS (UG & PG), Student READY and Inspire related fellowship works.
- All India VC Conference related works viz., preparation of agendas and ATR.
- IAUA related correspondences.
- Sanctions of Seminar/Symposium/Trainings/Annual group meeting of AICRP and ICAR scheme staff.
- Works related to Forestry Faculty at DR office.
- Proposal of New ELPs & ELPs review, compilation of report and related works.
- Assisting in demand of Library Strengthening Grant
- Assisting in sanctions of Guest Lectures (from Indian faculty), Online lectures (from foreign faculty members), MoUs (National and International), Training Programmes, National Seminars/ Workshops/ Conferences under CAAST
- Assisting in sanctions of National and International Training of CAAST core faculties and CAAST PG students.
- Compiling Reporting (Annual/Quarterly/Weekly reporting/) at Unit level and CAAST secretariat office.
- NAHEP-CAAST-NAU Website information, Media Coverage, Success Stories
- Assisting in compiling specifications, preparing quotations and purchase proposals and its purchase.
- Assisting in all purchases of respective units as per the procurement manual provided by PIU, New Delhi
- Follow up of purchase related activities at Unit level and CAAST secretariat office
- Any other work related to purchase, billing and financial reporting at Unit level and CAAST secretariat office.
- Any other reporting asked by the PIU-NAHEP, New Delhi from time to time.
- Any works assigned by competent Authority from time to time

ટી.૫ ટેબલ ડૉ. બાલાજી મોહન મોટે, મદદનીશ પ્રાધ્યાપક

- ઝડપારાઇએસી/એગ્રેસ્કો/જોઇન્ટ એગ્રેસ્કો/કાબ્યાઇન્ડ જોઇન્ટ એગ્રેસ્કોની કામગીરી
- ભલામણની બુકલેટ તૈયાર કરવી

Haile

સહ સંશોધન નિયામક (રીસર્ચ)

- સીડ સેલ યોજનાની તમામ કામગીરી
- હવામાન આધારીત પાક વીમા યોજનાની કામગીરી
- SMSP યોજના અંગેની કામગીરી
- એગ્રેસ્કોમાં મંજુર થયેલ જાતોને સ્ટેટ સીડ કમિટી, વેરાયટી નોટીફિકેશન વિગેરની કામગીરી
- PPVFRA, Meteorological/Weather data/Annual Report ની કામગીરી
- PME Sub cell અંતર્ગત વિવિધ પેટા કેન્દ્રોના રીસર્ચ પેપર પબ્લિકેશન માટેની મંજુરી તથા પત્રવ્યવહાર
- RRC meeting related works.
- નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચરની અને ડબ્લીંગ ફાર્મ ઇન્કમ (Doubling farm income)ની કામગીરી
- કચેરીના વડા તરફથી સોપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

ટી.૬ ટેબલ શ્રી. એચ.કે.ચૌધરી, ખેતીવાડી અધિકારી

- સંશોધન નિયામકશીની કચેરી તેમજ કાસ્ટ યોજનાના ડેડસ્ટોક તથા તેને લગતા રજુસ્ટર નિભાવવા તથા તેને લગતી સંપૂર્ણ કામગીરી કરવી.
- પ્રો-એક્ટીવ ડિસ્કલોઝરની કામગીરી કરવી
- આર.ટી.આઈ.ની કામગીરી કરવી.
- RA/SRF/JRF તેમજ અન્ય કોન્ટ્રાક્ચ્યુલ ની સધળી કામગીરીઓ
- ટી.૩ ટેબલ અને ટી.૪ ટેબલની કામગીરીમાં મદદરૂપ થવું
- કૃષિ ભાવપંચ અને પાક ઉત્પાદન ખર્ચ અંગેની કામગીરી
- સરદાર સરોવર યોજના અને સોઇલ હેલ્થ કાર્ડની તમામ કામગીરીઓ
- સેમીનાર, સીમ્પોઝીયમ, તાલીમ, વર્કશોપ, વિન્ટર/સમર સ્કુલ ટ્રેનીંગમાં ભાગ લેવાની મંજુરી અંગેની કામગીરી
- ઓફિસ લાયબ્રેરીની કામગીરી
- કચેરીના વડા તરફથી સોપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

ટી.૭ ટેબલ શ્રી મયુરભાઈ જ. પટેલ, ખેતી મદદનીશ

- કચેરીની ખરીદીની કામગીરી અને તેને લગતા તમામ રજુસ્ટરો નિભાવવાની કામગીરી
- કચેરીની સ્થાનિક મંજુરીની કામગીરી
- કચેરીની ભૌતિક યકાસણી કરવાની કામગીરી
- કચેરીના PFMS પોર્ટલની કામગીરી
- કચેરીના ઉપયોગ માટે કન્યાયુમેબલ અને સ્ટેશનરીની ખરીદી તથા રીકર્ડિંગ અને નોન રીકર્ડિંગની ખરીદીની કામગીરી તથા તેને લગતા રજુસ્ટરો નિભાવવાની કામગીરી (ડેડસ્ટોક સિવાય)
- ઝેરોક્ષ તેમજ અન્ય સાધનો કમ્પ્યુટરને લગતી તમામ કામગીરી
- કચેરીના વાહનો /બિલ્ડિંગની જાળવણીની કામગીરી
- ઓનલાઇન મીટિંગને લગતી કામગીરી
- ઓફિસ વેબસાઇટ અપડેટની કામગીરી
- કમ્પ્યુટર/પ્રિન્ટર હિસ્ટ્રી રજુસ્ટર, ઝેરોક્ષ હિસ્ટ્રી રજુસ્ટર, એસી હિસ્ટ્રી રજુસ્ટર, આર.ઓ.પ્લાન્ટ હિસ્ટ્રી રજુસ્ટર, ન્યુઝ પેપર હિસ્ટ્રી રજુસ્ટર, બુક પ્રિન્ટિંગ રજુસ્ટર, ઓફિસ ખર્ચ રજુસ્ટર નિભાવવાની કામગીરી
- CAAST PROJECT ની કામગીરી
- CAAST PROJECT ના યુનિટો ધ્વારા નોડલ સેલ ધ્વારા ખરીદી કરી રજુ કરેલ બીલોની સ્થાનિક મંજુરી અને તેને લગતા રજુસ્ટરો નિભાવવાની કામગીરી
- CAAST PROJECTના બીલોનું PFMS મારફત પેમેન્ટ કરવાની કામગીરી
- CAAST PROJECT ના કન્યાયુમેબલ અને સ્ટેશનરીની ખરીદીની કામગીરી તથા *તેનું* લગતા રજુસ્ટર

નિભાવવાની કામગીરી

- કચેરીના વડા તરફથી સોપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

ટી.૮ ટેબલ સમતાબેન વજુભાઈ ખટાણા, ખેતી મદદનીશ

- કચેરીના ઇનવર્ક આઉટવર્ક રજુસ્ટરો તથા સ્ટેપ્ર રજુસ્ટર નિભાવવાની કામગીરી
- ખાનગી અહેવાલની તમામ પ્રકારની કામગીરી કરવી
- સીક્યુરિટી અંગેની તમામ કામગીરી (ટી.૧)ના માર્ગદર્શન હેઠળ કરવી
- દરેક સંશોધન કેન્દ્રોમાં ઉત્પાદિત થતા બિયારણ, જનરલ બિયારણમાં આવેલ ઘટ માંડવાળ તથા જનરલ વેચાણ કરવાની મંજુરી અંગેની કામગીરી (ટી.૧) માર્ગદર્શન હેઠળ કરવી
- અધર એજન્સી યોજનાનું રજુસ્ટર અને ટેકનીકલ મંજુરી રજુસ્ટર નિભાવવું
- ટી.૧, ટી.૨ ટેકનીકલ પત્રવ્યવહાર ની કામગીરી

શ્રીમતી સપના ટી.આર. (પી.એસ ટુ ડી.આર)

- સંશોધન નિયામકશીના રહસ્ય સચિવ તરીકેની કામગીરી
- સંશોધન નિયામકશી તરફથી રવાના કરવાના થતા ખાનગી/અર્ધ સરકારી, અંગ્રેજી પત્રો ટાઇપિંગની કામગીરી
- સંશોધન નિયામકશીના કચેરીના ટેલીફોન બીલ રજુસ્ટર અને સ્થાનિક રજુસ્ટર મંજુરી અંગેની કામગીરી
- કચેરીના મોબાઇલ અંગેનું બીલ રજુસ્ટર તથા સ્થાનિક રજુસ્ટર મંજુરી અંગેની કામગીરી
- કચેરીની રોજબરોજની ટપાલનું ટેબલ માર્કીંગની કામગીરી
- સહ સંશોધન નિયામકશીના પી.એસ. તરીકેની કામગીરી
- માન. કુલપતિશ્રીની સહી મુકવા અંગેની કામગીરી તેમજ મુવમેન્ટ રજુસ્ટર નિભાવવા અંગેની કામગીરી
- કચેરીની ઇ-મેઇલ અંગેની તમામ કામગીરી
- એબરસ્ટ્રેક્ટ બીલ ઉપાડી તેમજ તેનો હિસાબ રજુ કરવા અંગેની તમામ કામગીરી
- અત્રેની કચેરીની મીટિંગ અંગેની તમામ પ્રકારની વ્યવસ્થા કરવી. તેમજ મીટિંગ અંગેના રજુસ્ટર નિભાવવા
- સંશોધન નિયામકશીને ફાળવેલ વાહનોની લોગબુક તથા બાઇકની લોગબુક નિભાવવાની રીપેરીંગ હિસ્ટ્રીસીટ Fastag રજુસ્ટર ફાઇલ, વીમો વિગેરેની તમામ કામગીરી
- આર.ટી.આઈ.ની અપીલ અંગેના રજુસ્ટર નિભાવવા
- ખાનગી ટપાલોના ઇનવર્ક/આઉટવર્ક તેમજ રજુસ્ટરો નિભાવવા અંગેની કામગીરી
- કચેરીના વડા તરફથી સોપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

PO.1 શ્રી પી.વી. લીલબાચીયા, ખેતી અધિકારી

- આયોજન અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી કરવી.
- દરેક કેન્દ્રો/કચેરી વિભાગો પાસેથી વિકાસ ખર્ચ યોજનાઓના અંદાજોની ચકાસણી કરવી
- વિકાસ ખર્ચ યોજનાઓની ચાલુ બાબતો, નવી બાબતો અને સુધારેલા અંદાજોની દરખાસ્તો તૈયાર કરવી તથા ઓનલાઇન ઓફલાઇન ફોર્મ તૈયાર કરી અને ગ્રાન્ટની ફાળવણીની કામગીરી
- યુનિવર્સિટી વેબસાઇટ પર અત્રેની કચેરીના વેબપેઇઝને અધતન કરવા અંગેની કામગીરી
- અત્રેની કચેરીને લગતા અગત્યના પરિપત્રો અને માહિતી ઓનલાઇન અપલોડ કરવાની કામગીરી
- વિકાસ ખર્ચ યોજના અને GeM ને લગતી ખરીદી માટેની ફાઇલની ચકાસણી કરવી
- દર ત્રણ મહિને ગ્રાન્ટ ફાળવણીની સમીક્ષા/રીવ્યુ બેઠકને લગતી કામગીરીમાં મદદ કરવી.
- પ્લાનિંગ એન્ડ ડેવલોપમેન્ટ કમિટી મીટિંગને લગતી કામગીરીમાં મદદ કરવી.
- સરકારશ્રીમાં રજુ કરવાના થતા નવા બાંધકામો અને નવા કાર્યક્રમો તેમજ નોન રીપેરીંગ સાધનોની માંગણી દરેક કેન્દ્રો /કચેરી/વિભાગો પાસેથી મંગાવી ચકાસણીમાં મદદ કરવી અને દરખાસ્તો તૈયાર કરવી.

Maile

- ઝોનના યુનિટ/સબ યુનિટ અધિકારીઓની તેમજ અત્રેની કચેરીના અધિકારીઓના પ્રવાસ મંજુરીની ઓનલાઇન કામગીરી કરવી
- યુનિવર્સિટી બજેટ સંકલનની કામગીરીમાં મદદ કરવી
- આયોજનને લગતા માસિક/ત્રિમાસિક/વાર્ષિક રીપોર્ટની કામગીરીમાં મદદ કરવી
- ગુજરાતી અને અંગ્રેજી ટાઇપીંગ તથા પ્લાન યોજનાની ફાઇલો નિભાવવી
- આયોજન અધિકારી સાથેની સઘળી કામગીરી
- કચેરીના વડા તરફથી સોપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

સંશોધન નિયામકશીની કચેરી વહીવટી/હિસાબી ટેબલોની કામગીરીની વહેંચણી

કચેરી અધિક્ષક (ખાલી જગ્યા)

એ.૧ ટેબલ શ્રી દિલીપકુમાર એમ.પટેલ, સીનીયર કલાર્ક

- કચેરીના તમામ અધિકારી /કર્મચારીઓની સર્વિસબુક અંગેની તમામ પ્રકારની કામગીરી
- અત્રેની કચેરીના તમામ અધિકારી/કર્મચારીઓની તથા યુનિટ, સબ યુનિટ અધિકારીશીઓની LTC, Home Town અંગેની દરખાસ્ત કરવી તેમજ તમામ પ્રકારની રજાઓ મંજુર કરવાના કાર્યાલય આદેશ કરવાની કામગીરી
- ત્રિમાસિક ચાર્જપત્રક મોકલવા તથા નિભાવવા
- રોજગાર વિનીમય કચેરીમાં મોકલવાના થતા ER-1, ER-2 પત્રક મોકલવાની કામગીરી
- ઇલેક્શન અંગેની તમામ માહિતીની કામગીરી
- યુનિવર્સિટી તરફથી માંગવામાં આવતી અન્ય વહીવટી માહિતી મોકલવી
- અત્રેની કચેરીના અધિકારી/કર્મચારીઓના રીટાયરમેન્ટ વખતે પેન્શન પેપર બનાવવા અંગેની તમામ કામગીરી
- કર્મચારી/અધિકારીઓના કેરીયર એડવાન્સમેન્ટ, ઉચ્યતર પગાર ધોરણ, બઢતી વિગેરેની પગાર બાંધણીની દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી
- સંશોધન નિયામકશીની કચેરીના તથા કાસ્ટ યોજનાના ઉચ્યકદર /કોન્ટ્રાક્ચ્યુઅલ સર્વિસ અંગેના મસ્ટર બનાવવા તેમજ મંજુરોની ફાઇલ નિભાવવી.
- સબ યુનિટ કચેરીઓના ઉચ્યકદર /કોન્ટ્રાક્ચ્યુઅલ સર્વિસ અંગેની મંજુરી આપવા અંગેની કામગીરી
- કર્મચારીઓના પગાર ફિક્સેશન અંગેની કામગીરી
- વોટરશેડ યોજનાના ચુકવાયેલ નાણાં અંગેના પ્રમાણપત્ર આપવા અંગેની કામગીરી
- ઓડિટ પેરા હાલ માર્જિન વિગેરેના જવાબો કરવાની કામગીરી
- કચેરીના વડા તરફથી સોપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

એ.૩ ટેબલ શ્રીમતિ એ.એસ.પટેલ, હેડ કલાર્ક

- આયોજન અધિકારીશીના નિયંત્રણ હેઠળ મંજુરીની કામગીરી કરવી
- યુનિવર્સિટીના તમામ વિભાગો/કેન્દ્રોની ખરીદીની મંજુરી/ખરીદી અને ફાળવણી/રેકૉર્ડની કામગીરી
- પ્રોટેક્ટીવેર્સમાં મંજુરી/ખરીદી અને ફાળવણીની કામગીરી
- ઝોનના યુનિટ/સબ યુનિટ અધિકારીઓની તેમજ અત્રેની કચેરીના અધિકારી/કર્મચારીઓના તેમજ કાસ્ટ યોજનાની પ્રવાસ ડાયરી મંજુર કરવી તેમજ રજુસ્ટર નિભાવવા
- કાસ્ટ યોજનાની ખરીદીની મંજુરી અંગેની કામગીરી તેમજ તે અંગેના રજુસ્ટર નિભાવવા તેમજ કાસ્ટ યોજનાની કેશબુક ચકાસણી કરી પ્રતિ સહી કરવી
- મંજુર મસ્ટર બીલ, પેએબલ ડિસીબીલ કચેરીના તેમજ કાસ્ટ યોજનાના તમામ બીલો ચકાસણી કરી પ્રતિ

Maile

સહ સંશોધન નિયામક(રીસર્ચ)

સહી કરવી

- અતેની કચેરીના પ્લાન અને નોન પ્લાન બજેટ બનાવવાની કામગીરી
- યુનિટ/સબ યુનિટ અધિકારીઓ તરફથી આવતા પ્લાન/નોન પ્લાન બજેટને ચેક કરી હિસાબ નિયામક્ષીની કચેરીમાં મોકલવાની કામગીરી
- સ્ટાફની કામગીરીનું સુપરવીઝન (કચેરી અધિકારીની વધારાની કામગીરી)
- કચેરીના વડા તરફથી સોપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

એ.૪ ટેબલ શ્રીમતિ સોનલબેન બી. ગરાસીયા, સીનિયર કલાર્ક

- કચેરીના દરેક કર્મચારી/અધિકારીઓના માસિક પગાર બીલ, એડવાન્સ તથા જી.એસ.એલ.આઇના રજુસ્ટરો, એરીયર્સ બીલ બનાવવાની કામગીરી
- માસિક આવક ખર્ચના રજુસ્ટર નિભાવવા
- કાસ્ટ પ્રોજેક્ટના પેચેબલ ડિસીબીલ, નોટ પેચેબલ ડિસીબીલ બીલો ચેક કરવાની, કેશબુક રોજબરોજ નિભાવવી તથા કેશબુક સાથેના ચેક રજુસ્ટર, રસીદબુક, ચલન રજુસ્ટર, ચલન ફાઇલ વિગેરની કામગીરી.
- ટી.એ.બીલ, પી.એક્ઝ.બીલ, પી.એક્ઝ.દરખાસ્ત, ઇન્કમટેક્ષ કપાત, તેમજ રીટર્ન ફાઇલ, પ્રોફેશનલ ટેક્ષ, ઇન્કમટેક્ષ અંગેના રજુસ્ટરો તથા ચલન ફાઇલ નિભાવવી તથા જીએસટી અંગેની કામગીરી
- પેચેબલ ડિસીબીલ, નોટ પેચેબલ ડિસીબીલ, એબસ્ટ્રેક બીલ, લાઇટ બીલ, મજુર મસ્ટર વિવિધ બીલો અંગેની કામગીરી
- કચેરીના વડા તરફથી સોપવામાં આવતી તમામ પ્રકારની કામગીરી

મુદ્દા નંબર-૩ : દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ:-

- યુનિવર્સિટી હસ્તકના વિવિધ સંશોધન કેન્દ્રો/વિભાગો કરા ચાલતી સંશોધન યોજનાઓ અને પ્રવૃત્તિઓની સંપર્ક દેખરેખ અને માર્ગદર્શન આપવું તેમજ વર્ષના અંતિત સંબંધિત પાકોના સંશોધન વૈજ્ઞાનિકશીઓ તેમજ જુદી જુદી શાખાઓના આચાર્યશ્રીઓ સાથે સંકલન કરી વર્ષ દરમ્યાન એગ્રેસ્કો સબ કમીટી મારફત ખેડૂતઉપયોગી ભલામણોની મંજુરી આપવી તેમજ આગામી વર્ષમાં જુદા જુદા પાકોમાં ખેડૂતોને મુજબતા પ્રશ્નોને ધ્યાને લઈ નવા ટેકનીકલ પ્રોગ્રામ તૈયાર કરી મંજુર કરવાની કામગીરી.
- રીસર્ચ કાઉન્સિલ મારફત નવા સંશોધન સંલાન તકનીકી કાર્યક્રમમાં જરૂરી સુધારો કરી અમલીકરણ માટે મંજુરી આપવી.
- યુનિવર્સિટી હસ્તક ચાલતા અનુસ્નાતક શિક્ષણ ક્ષેત્રે વિવિધ ડિસીપ્લ્ટીનમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓની પ્રવેશની કામગીરી, પ્રવેશ ક્ષમતા તેમજ જરૂરી નવા અભ્યાસક્રમો સમયાંતરે શરૂ કરવા માટે પી.જી. બોર્ડ ઓફ સ્ટડીઝમાં મંજુરી માટે રજુ કરવું.
- જો જરૂર જણાય તો સંશોધન તેમજ શિક્ષણ સંલાન બાબતોની મંજુરી વિદ્યા પરિષદ તેમજ સંચાલક મંડળમાં રજુ કરવામાં આવે છે.
- અનુસ્નાતક વિદ્યાર્થીઓને લગતા તમામ સાધનીક રેકર્ડની નિભાવણી તેમજ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સતત દેખરેખ/મોનીટરીંગ કરવું.
- નવીનતમ ખેડૂત ઉપયોગી સંશોધન કામગીરીને વેગવંતી બનાવવા માટે જુદી જુદી સરકાર માન્ય સંસ્થા/માનગી સંસ્થાઓ સાથે એમ.એ.ઓ.યુ. કરવાની કામગીરી.
- યુનિવર્સિટીની સ્ટેચ્યુટરી જોગવાઈ મુજબ વહીવટી/હિસાબી કામગીરીને મંજુરી આપવી.
- યુનિવર્સિટીના પ્લાન અને આઈ.સી.એ.આર. યોજનાના બજેટની ફાળવણી અને સમીક્ષા કરવી.
- ખેતી કાર્યો અને કૃષિ પેદાશના ભાવો નક્કી કરી અમલમાં મુકવા.
- અધર એજન્સી પ્રોજેક્ટ તૈયાર કરવા અને અમલવારી કરવી.

Nagle

સહ સંશોધન નિયામક(રીસર્ચ)

➤ આયોજનની કામગીરી, ફાયનાન્સ કમિટી, વિદ્યાપરિષદ તેમજ સંચાલન મંડળમાં યોજનાઓ રજુ કરવી.

મુદ્દા નંબર-૪ : પોતાના કાર્યો બજાવવા પોતે નક્કી કરેલા ધોરણો :-

- અત્રેની કચેરી સંબંધિત સંશોધન અને અનુસ્નાતક અભ્યાસકમને લગતી સઘળી તકનીકી કામગીરી તથા વહીવટી કર્મચારીઓ દ્વારા કચેરીને લગતી તમામ પ્રકારની વહીવટી/હિસાબી કામગીરી યુનિવર્સિટીના નીતિ-નિયમો મુજબ કરવામાં આવે છે.
- યુનિવર્સિટીના દરેક સંશોધન કેન્દ્રોની તાંત્રિક કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે.
- પી.જી. અભ્યાસકમની કામગીરી
- સંશોધન યોજનાઓની ખરીદીની મંજુરી
- કાર્યરત રીસર્ચ પ્રોજેક્ટોનું મુલ્યાંકન અને સમીક્ષા
- નવા પ્રોજેક્ટો તૈયાર કરી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજુ કરવા.
- ઉપરોક્ત કાર્યો યુનિવર્સિટીના ધારા નં. ૧૨૧ ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ (સત્તા સૌપણી) નિયમો, ૨૦૧૧ મુજબ કરવામાં આવે છે.

મુદ્દા નં. ૫ : પોતાના કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા પોતાના નિયંત્રણ હેઠળના અથવા પોતાના કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસગ્રહો અને રેકર્ડ:-

- કૃષિ યુનિવર્સિટીની સ્ટેચ્યુટરી જોગવાઈઓ મુજબ નિયમો, વિનિયોગ અને સુચનાઓને અનુસરવામાં આવે છે તેમજ માન. રાજ્ય સરકારશીના કૃષિ અને સહકાર વિભાગના આદેશો અનુસાર કામગીરી કરવામાં આવે છે તથા હિસાબી કામગીરીનું લોકલ ફેડ ઓડિટરશી દ્વારા ઓડિટ કરાવવામાં આવે છે તેમજ અત્રેના કેન્દ્ર દ્વારા જરૂરી રજીસ્ટરો જેવા કે ડેડસ્ટોક, લેબર સીટ, હાજરી પત્રક, રીપેરીંગ, વાહનની લોગબુક, હિસ્ટ્રીશીટ, પરચુરણ રજા, ટપાલ આવક-જાવક તથા હિસાબી રજીસ્ટરો જેવા કે, કેશબુક, રસીદ બુક માસિક ખર્ચ પત્રક વિગેરેની નિભાવણી કરવામાં આવે છે.

મુદ્દા નંબર-૫ : પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોથ તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક :-

(૧)	આયોજન અધિકારી (ડૉ.એ.આર. લાઠીયા, આયોજન અધિકારી) આયોજીત યોજનાના અનુદાનની વહેંચણી આયોજીત યોજનાની મંજુરી અને અમલીકરણ વિધાનસભા તારાંકિત પ્રશ્નો આઇસીએઆર ડેવલપમેન્ટ ગ્રાન્ટ આયોજીત યોજનાની તાંત્રિક કામગીરી કલાસીકાઇડ વર્કસ બજેટની કામગીરી પ્લાનિંગ અને ડેવલોપમેન્ટ કમિટીની કામગીરી બોર્ડ ઓફ મેનેજમેન્ટ ગુજરાત સરકારશી સાથેના યોજનાકીય પત્રવ્યવહાર રાજ્ય કૃષિ યુનિવર્સિટી કાઉન્સિલને લગતી કામગીરી
(૨)	PO1, આયોજન શાખા (ખાલી જગ્યા) પ્લાનના નવા પ્રોજેક્ટને લગતી ફાઇલો

	એન્યુઅલ ડેવલપમેન્ટ પ્લાન / બજેટને લગતી ફાઇલો
	સ્થાયી પરામર્શ સમિતિ અંગેની ફાઇલ
	પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટી(PDC) ની ફાઇલ
	સ્ટેટ એગ્રીકલ્યર કાઉન્સિલની ફાઇલ
	ગુજરાત સરકારશ્રી સાથેના યોજનાકીય પત્રવ્યવહાર
(3)	PO2, શ્રી પી. વી. લીલાચારીયા, ખેતી અધિકારી પરચેઇઝ કમિટીની ફાઇલ રેટ કોન્ટ્રાક્ટની ફાઇલ ઈ-ટેન્ડરિંગની ફાઇલ દુર પ્રોગ્રામ એપ્યુવલની ફાઇલ
(4)	PO3, આયોજન શાખા (જી. કલાર્ક) ખાતી જગ્યા પ્લાન યોજનાના બજેટની ફાઇલ પ્લાન યોજનાના બજેટ અંગેના પત્ર વ્યવહારની ફાઇલ સરકારશ્રી સાથેના પત્ર વ્યવહારની ફાઇલ પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટની ફાઇલ
(5)	ટી-૧ ટેબલ (ડૉ. જી.ડી.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક) અધર એજન્સીના તમામ પ્રોજેક્ટો (પ્રાઈવેટ કંપનીઓ) રીસર્ચ કાઉન્સિલની ફાઇલ બિયારણ, રોપા, કલમો વિ. ઘર માંડવાળ બી.ટી. કોટનને લગતા સધળા પત્રવ્યવહારને લગતી તમામ ફાઇલ અન્ય ચીજવસ્તુ ઘર માંડવાળ / રદબાતલની ફાઇલ
(6)	ટી-૨ ટેબલ (ડૉ. બી.બી.પટેલ, મદદનીશ પ્રાધ્યાપક) આર.કે.વી.વાય.ના તમામ પ્રોજેક્ટો નેશનલ હોટીકલ્યર મિશનના સીડ સિવાયના પ્રોજેક્ટો યુનિવર્સિટીની દરેક કેન્દ્રની જમીનના દસ્તાવેજો યુનિવર્સિટીની જમીનને લગતા પ્રશ્નોની ફાઇલ ગુજરાત સરકાર સાથેના તાંત્રિક પ્રશ્નો કન્ટીજન્સી પ્લાન કેન્દ્રો/પેટા કેન્દ્રોના પ્રશ્નો અને તેના નિરાકરણ હવામાન આધારિત પાક વિમા યોજના પાક યોજના (જનરલ અને અખતરા)ની મંજુરીની ફાઇલ પાક ધિરાણ નોમર્સ, નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્યર ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ, પ્રધાનમંત્રી કિસાન સિંચાઇ યોજના સેન્ટ્રિય ખેતી પદ્ધતિની ફાઇલ ઉચ્ચક દરોથી ખેતી કાર્યોના ભાવ બાબત રીવોલ્વીંગ ફંડમાંથી કરવામાં આવતા કામોની મંજુરીની ફાઇલ
(7)	ટી-૩ ટેબલ (ડૉ. દિનેશ એચ. ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક) અનુસ્નાતક અભ્યાસક્રમ સંબંધિત તમામ સાધનિક કામગીરીની ફાઇલ અનુસ્નાતક વિદ્યાર્થીની સીનોપ્સીસ એપ્યુલની ફાઇલ

Maile

	એકેડમીક કાઉન્સિલની ફાઈલ
	એવોર્ડની ફાઈલ
	પી.જી. બોર્ડની ફાઈલ
	એમ.ઓ.યુ.ની ફાઈલ / ફોરન ટ્રેનીંગ/સીમ્પોઝીયમ/વર્ક્ષોપની ફાઈલ
	એમઅયુ રજીસ્ટર, સર્ટીફીકેશનની અસલ ફાઈલો
(૮)	ટી-૪ ટેબલ (ડૉ. એમ.એસ. શાંકનુર, મદદનીશ પ્રાધ્યાપક)
	આઇસીએઆર રીજ્યુનલ કમિટી રીપોર્ટ
	આઇસીએઆર રીપોર્ટ
	આઇસીએઆર તથા ભારત સરકારની યોજના
	આઇસીએઆર તથા ભારત સરકાર સાથેના પત્રવ્યવહારની ફાઈલ
(૯)	ટી-૫ ટેબલ (શ્રી બાલાજી મોહન મોટે, મદદનીશ પ્રાધ્યાપક)
	એગ્રેસ્કો સબ કમિટીની ફાઈલ(વર્ષવાર), ઝડપોરસીની ફાઈલ
	જોઈન્ટ એગ્રેસ્કોની ફાઈલ(વર્ષવાર)
	કંબાઈન્ડ જોઈન્ટ એગ્રેસ્કો ફાઈલ(વર્ષવાર)
	ભલામણની પુસ્તિકા (અંગ્રેજી-વર્ષવાર)
	બીજ ઉત્પાદન કાર્યકમના આયોજન અને અમલીકરણની ફાઈલ
	સીડ વિલેજ યોજનાનું સંકલન
	સીડ અંગેના નવા પ્રોજેક્ટ
	નેશનલ હોટીલલ્યુર મિશન (સીડ)
	સ્ટેટ સીડ કમિટી
	વેરાયટી નોટીફીકેશન/ રજીસ્ટ્રેશનની ફાઈલ
(૧૦)	ટી-૬ (શ્રી એચ.કે.ચૌધરી, ખેતી અધિકારી)
	ડેસ્ટોક રજીસ્ટર CAAST Project અને ડીઆર ઓફિસ
	આર.ટી.આઇ. રજીસ્ટર
	પ્રોએક્ટિવ ડિસ્કલોઝર ફાઈલ
	આર.એ. અને એસ.આર.એફ. ના ઓર્ડરની ફાઈલ
	આર.એ. / એસ.આર.એફ. ની ટેકનીકલ મંજુરી
	સોઈલ હેલ્થ કાર્ડ અંગેની ફાઈલ
	સરદાર સરોવર પ્રોજેક્ટના અમલીકરણ, બજેટ અને અહેવાલ
	કુષ્ણ ભાવ પંચ (વર્ષવાર)
(૧૧)	ટી-૭ (શ્રી મધુરભાઈ જે. પટેલ, ખેતી મદદનીશ)
	કચેરીની ખરીદીની ફાઈલ
	કચેરીની ભૌતિક ચકાસણીની ફાઈલ
	સ્થાનિક મંજુરી રજીસ્ટર
	કન્યામેબલ રજીસ્ટર
	સ્ટેશનરી રજીસ્ટર
	આર. ઓ. પલાન્ટ હિસ્ટ્રી રજીસ્ટર
	જાહેરાત રજીસ્ટર
	ન્યુઅપેપર રજીસ્ટર
	કોમ્પ્યુટર હિસ્ટ્રી રજીસ્ટર

સહ સંશોધન નિયામક(રીસર્ચ)

	રીપેરીંગ રજુસ્ટર (પરચુરણ)
	એ.સી.મશીન હિસ્ટ્રી રજુસ્ટર
	ઝરોક્ષ મશીન હિસ્ટ્રી રજુસ્ટર
	દ્વાહીલર બાઇકની લોગબુક
	દ્વાહીલર બાઇકની હીસ્ટ્રીશીટ અને સ્કેપ રજુસ્ટર
	CAAST Project File
	CAAST Project ના સ્થાનિક મંજુરી રજુસ્ટર
	CAAST Project ના કન્જર્યુમેબલ રજુસ્ટર
	CAAST Project ના સ્ટેશનરી રજુસ્ટર
	CAAST Project ના ડેડસ્ટોક રજુસ્ટર
	CAAST Project ના જનરલ એક્ષપેન્ડીચર રજુસ્ટર
(૧૨)	પીએસ ટુ ઓડીઆર (ખાલી જગ્યા, સ્ટેનો ગ્રેડ-૨)
	કચેરીની ગાડીની લોગબુક
	કચેરીની ગાડીની હીસ્ટ્રીશીટ અને સ્કેપ રજુસ્ટર
	કચેરીની ગાડીનું રીપેરીંગ ખર્ચની મંજુરી
	કચેરીની ગાડીનાં વીમાની ફાઈલ
	જુઝે.૨૧ એમ ૬૬૭૭ ડીઝલ રજુસ્ટર
	કચેરીની ગાડી ખરીદી અંગેની ફાઈલ
(૧૩)	પીએસ ટુ ડીઆર (શ્રીમતી સપના ટી. આર., સ્ટેનો ગ્રેડ-૨)
	સંશોધન નિયામકશીની ગાડીની લોગબુક
	કચેરીના ટેલીફોન બીલ રજુસ્ટર
	કચેરીના મોબાઇલ બીલ રજુસ્ટર
	કચેરીના રીલાયન્સ ઈન્ટરનેટ કેનક્શન
	કચેરીના ટેબલેટ બીલ રજુસ્ટર
	સંશોધન નિયામકશીની ગાડીનું ડીઝલ રજુસ્ટર
	ખાનગી પત્રોની ફાઈલ
(૧૪)	કચેરી અધિક્ષક
	ઓડીટ પેરાની ફાઈલ (વર્ષવાર)
	હાફ માર્જિનની ફાઈલ (વર્ષવાર)
(૧૫)	એ.૧ ટેબલ શ્રી દિલીપકુમાર એમ.પટેલ, સીનીયર કલાર્ક
	કચેરીનાં કર્મચારી / અધિકારીની સેવાપોથી
	કચેરીનાં કર્મચારી / અધિકારીશ્રીઓની રજા મંજુરી અંગે
	વોટરશેડ યોજના ચુકવાયેલ નાણાં અંગેના પ્રમાણપત્ર આપવા
	ગુપ્ત અહેવાલનું ઈન્વર્ક / આઉટવર્ક કરવું
	ત્રિમાસિક ચાર્જ પત્રક
	પેન્સન પેપરની ફાઈલ
	કર્મચારી/અધિકારીનાં પગાર ફીક્શનની ફાઈલ
	ઉચ્ચક દરનાં મંજુરીની ફાઈલ
	કોન્ટ્રાક્ટચ્યુલ સેવા મંજુરીની ફાઈલ
(૧૬)	એ.૨ ટેબલ, જુનિયર કલાર્ક (ખાલી જગ્યા)

Minal

	પએબલ બીલની ફાઈલ
	નોટ પએબલ બીલની ફાઈલ
	કેશબુક
	ચેક રજીસ્ટર
	રસીદ બુક
	ચલન રજીસ્ટર અને ચલન ફાઈલ
	પ્રો.ટેક્ષ અને ઈન્કમટેક્ષ અંગેનું રજીસ્ટર
	ઓબસ્ટ્રેક બીલ રજીસ્ટર
	ટ્રેઝરી રજીસ્ટર
	અનામત રજીસ્ટર
	રીફન્ડ બીલ રજીસ્ટર
(૧૭)	એ.૩ ટેબલ શ્રીમતિ એ.એસ.પટેલ, હેડ કલાર્ક યુનિવર્સિટીનાં તમામ વિભાગ/કેન્દ્રની મંજુરીની ફાઈલ કર્મચારીનાં પ્રોટેક્ટીવેર્સ અંગેની ફાઈલ પ્રોટેક્ટીવ મંજુરી અને ફાળવણીની કામગીરી પ્રોટેક્ટીવ વર્સ / ગણવેશ રજીસ્ટર પ્રવાસ ડાયરી રજીસ્ટર પ્રવાસ મંજુરી રજીસ્ટર ટ્રેનીંગ, સેમીનર, સીમ્પોઝીયમની મંજુરીની ફાઈલ
(૧૮)	એ.૪ ટેબલ શ્રીમતિ સોનલબેન બી. ગરાસીયા, સીનિયર કલાર્ક કર્મચારી/અધિકારીનાં પગાર ભથ્થા રજીસ્ટર જીએસએલઆઈ રજીસ્ટર એડવાન્સ પેમેન્ટ અંગેની રજીસ્ટર ટી.એ.બીલ . રજીસ્ટર પી.એફ.રજીસ્ટર આઈ.ટી.રજીસ્ટર(ફોર્મ-૧૬) એમ.ઈ.એસ.રજીસ્ટર ગ્રાન્ટ રજીસ્ટર કન્ટીજન્સી વાઉચર રજીસ્ટર પી.એફ.પાસબુક જુદા જુદા સંશોધન કેન્દ્રની આર.ટી.આઈ.ની અલગ ફાઈલ આર.ટી.આઈના રીપોર્ટની ફાઈલ બજેટની ફાઈલ બજેટ રજીસ્ટર
(૧૯)	ટી.૮ કુ. સમતાબેન વી. ખટાણે, ખેતી મદદનીશ ખાનગી આઉટવર્ડ અને ઇનવર્ડ રજીસ્ટર ખાનગી અહેવાલ ફોર્મ રીપોર્ટિંગ/રીવ્યુની ફાઈલ કર્મચારી/અધિકારીઓના દરેક કેન્દ્રના ખાનગી અહેવાલની ફાઈલ સિક્યુરિટીને લગતા રજીસ્ટર નિભાવવા

Yajle

સહ સંશોધન નિયામક(રીસર્ચ)

મુદ્રા નંબર-૭ : તેની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણ સંબંધમાં જનતાના સહ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના ગ્રારા રજુઆત માટેની વિદ્યમાન કોઈ વ્યવસ્થાની વિગતો :-

- અતેની કચેરીમાં માત્ર યુનિવર્સિટી ખાતે ચાલતી સંશોધન અને અનુસ્નાતક શિક્ષણ ક્ષેત્રે ચાલતી કામગીરી હોય જનતાના સહ્યો સાથે સીધો સંપર્ક રહેતો નથી, જેથી લાગુ પડતું નથી.

મુદ્રા નંબર-૮ : તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી બધું વ્યક્તિત્વોના બનેલા બોર્ડ, કાઉન્સિલો, સમિતિ અને બીજા મંડળોનું પત્રક અને તે બોર્ડ, કાઉન્સિલો, સમિતિ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ ?

- પી.જી. બોર્ડ ઓફ સ્ટડી-અનુસ્નાતક અભ્યાસક્રમ સંબંધિત પ્રશ્નો અને નિરાકરણ માટે
- રીસર્ચ કાઉન્સિલ-સંશોધન લગતા તાત્કાલિક અને વહીવટ પ્રશ્નો અને નિરાકરણ
- રીસર્ચ સબકમીટી-નવા ટેકનીકલ પ્રોગ્રામ નકદી કરવા તથા સંશોધન કાર્યોનું મુલ્યાંકન કરવા માટે અને આ કમીટી ગ્રારા ખેડૂતોપયોગી ભલામણો પુસ્તીકાના રૂપમાં તૈયાર કરવામાં આવે તથા યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર રજુ કરવામાં આવે છે.
- પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ કમીટી- યુનિવર્સિટી કક્ષાનું માસ્ટર પ્લાન તૈયાર કરવો, નવા પ્રોજેક્ટોનું સ્કુટીની કરી સરકારશ્રીમાં રજુ કરવા, શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના વિવિધ પ્રોગ્રામો તૈયાર કરવા અને નિયામક મંડળને ભલામણ કરવી, પરસ્પેક્ટિવ પ્લાન તૈયાર કરવા, વિવિધ યોજનાઓના પ્રોગ્રાસની સમીક્ષા કરવા તેમજ યુનિવર્સિટીના માસ્ટર પ્લાનને સતત અધ્યતન કરવાની કામગીરી માટે

ઉપરોક્ત કમીટી/કાઉન્સિલમાં ફક્ત નિમણુંક કરેલ સભ્યશ્રીઓ ભાગ લઈ શકતા હોય સામાન્ય નાગરિક માટે પ્રવેશ નથી તેમજ ઉપરોક્ત કમીટી/કાઉન્સિલની કાર્યનોંધ યુનિવર્સિટીમાં અમલીકરણ પુરતી જ મર્યાદિત હોય છે.

મુદ્રા નંબર-૯ : તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :-

- નવસારી કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.nau.in પર માહિતી મુકવામાં આવેલ છે તેમજ આ સાથે એપેન્ટીક્ષ-એ (પી.જી. બોર્ડ ઓફ સ્ટડી), એપેન્ટીક્ષ-બી (રીસર્ચ કાઉન્સિલ), એપેન્ટીક્ષ-સી (એગ્રેસ્કો રીસર્ચ સબ કમીટી) અને એપેન્ટીક્ષ-ડી (પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ કમીટી) થી સામેલ છે.

એપેન્ટીક્ષ-એ (પી. જી. બોર્ડ ઓફ સ્ટડી)

Sr. No.	Name	Designation
1.	Dr. T.R. Ahlawat	Chairperson I/C. Director of Research and Dean PG. Studies, NAU, Navsari
2.	Dr. H.V. Pandya	I/C. Registrar, NAU, Navsari
3.	Dr. N.M. Chauhan	I/C. Director of Extension Education, NAU, Navsari
4.	Dr. R.M. Naik	Dean & Principal, N. M. Collage of Agriculture, NAU, Navsari
5.	Dr. Alka Singh	Dean & Principal, Aspee College of Horticulture, NAU, Navsari
6.	Dr. M. B. Patel	Dean & Principal, College of Forestry, NAU, Navsari
7.	Dr. Ruchira Sukla	I/C. Dean, Aspee Agri. Business Management Institute, NAU, Navsari
8.	Dr. D. D. Patel	Principal, Collage of Agriculture, NAU, Bharuch
9.	Dr. A. P. Patel	Principal, College of Agriculture, NAU, Waghai
10.	Dr. Sanjay Jha	Principal, Aspee Shakilam Biotechnology Institute, NAU, Surat
11.	Dr. P. K. Shrivastava	Principal, College of Agriculture Engineering & Technology, NAU, Dediapada
12.	Dr V R. Naik	Associate Director of Research (Res.), NAU, Navsari

Maile

13.	Dr. Lalit Mahatma	Associate Director of Research (Edu.) NAU, Navsari
14.	Dr. J.M. Patel	Research Scientist, SWMRU, NAU, Navsari
15.	Dr. D.K. Sharma	Research Scientist, Agricultural Experimental Station, NAU, Paria
16.	Dr. P. B. Patel	Research Scientist, SWMRU, NAU, Navsari
17.	Dr. R. P. Gunega	Associate Professor & PG Academica in-charge, CoF, NAU, Navsari
18.	Dr. R.V. Tank	Assoc. Professor & PG Academic In-Charge, Deptt. of Fruit Science, ACoH, NAU, Navsari
19.	Dr. H.M. Virdia	Research Scientist, Main Sugarcane Research Station, NAU, Navsari
20.	Prof. A. M. Patel	Assistant Registrar (Academic), NAU, Navsari Secretary

એપેન્ડિક્સ-બી (રીસર્ચ કાઉન્સિલ)

Sr.No	Name	Designation
Vice-Chancellor		
1.	Dr. Z. P. Patel	Vice-Chancellor, Navsari Agricultural University, Navsari
Director of Research		
2.	Dr. T.R. Ahlawat	I/c Director of Research, Navsari Agricultural University, Navsari
Director of Extension Education		
3.	Dr. N. M. Chauhan	I/c Director of Extension Education, NAU, Navsari
Associate Director of Research		
4.	Dr. V.R. Naik	Associate Director of Research, NAU, Navsari
5.	Dr. Lalit Mahatma	Associate Director of Research, NAU, Navsari
Deans		
6.	Dr. R. M. Naik	I/c Dean, Faculty of Agriculture, N. M. College of Agriculture, NAU, Navsari
7.	Dr. Alka Singh	Dean, Faculty of Horticulture, ASPEE College of Horticulture, NAU, Navsari
8.	Dr. P. K. Shrivastava	Dean, Faculty of Forestry, College of Forestry, NAU, Navsari
The Conveners of the AGRESCO sub-committees		
9.	Dr. Sonal Tripathi	Convener (NRM) & Associate Professor, Dept. of Soil Science and Agricultural Chemistry, NMCA, NAU, Navsari
10.	Dr. Hemant Sharma	Convener (Plant Protection) & Associate Professor, Dept. of Pathology, ACoH, NAU, Navsari.
11.	Dr. Bharat K. Davda	Convener (Crop Improvement) & Research Scientist, Main Sorghum Research Station, NAU, Surat
12.	Dr. Dev Raj	Convener (Horticulture) & Professor, Post-Harvest Technology, ACoH, NAU, Navsari.
13.	Dr. Sumankumar Jha	Convener (Forestry) & Associate Professor, Forest Biology & Tree Improvement, CoF, NAU, Navsari
14.	Dr. Rajkumar Katagi	Convener (Basic Science) & Assistant Research Scientist, Main Cotton Research Station, NAU, Surat
15.	Dr. Parag Pandit	Convener (Agril. Engineering) & Assistant Professor, ACH, NAU, Navsari
16.	Dr. Narendra Singh	Convener (Social Science) & Professor, Dept. of Economics, NMCA, NAU, Navsari
Two Eminent Scientists (Nominated by Vice-Chancellor)		
17.	Dr. B. N. Patel	Rtd. Dean, ASPEE College of Horticulture & Forestry, NAU, Navsari
18.	Dr. P. L. Saran	Principal Scientist, DMAPR, Boriyavi, Anand
Five Professor/Research Scientists (Nominated by Vice-Chancellor)		

Naile

19.	Dr. S. J. Patil	Professor, Dept. of Horticulture, NMCA, NAU, Navsari
20.	Dr. J. J. Pastagia	I/c Principal, College of Agriculture, NAU, Waghai
21.	Dr. Sanjay Jha	I/c Principal, ASPEE SHAKILAM Biotechnology Institute, NAU, Surat
22.	Dr. D. D. Patel	I/c Principal, College of Agriculture, NAU, Bharuch
23.	Dr. Pathik B. Patel	Associate Research Scientist, Main Rice Research Centre, SWMRU, NAU, Navsari

Progressive farmer (Nominated by Vice-Chancellor)

24.	Shri Manojbhai Rameshchandra Patel	At. Pathri, Chikuwadi Faliyu, Ta. Gandevi, Dist. Navsari
<u>The Directors of Agriculture/Horticulture</u>		
25.	Shri. S. J. Solanki	Director of Agriculture, Gujarat state
26.	Dr. P.M. Vaghasiya	Director of Horticulture, Gujarat state

એપેન્ડિક્સ-સી (એગ્રેસ્કો રીસર્ચ સબ કમિટી)

Sr. No.	Name of AGRESCO Sub-committee	Name of the Conveners with designation and address
1.	Plant Protection	Dr. Hemant Sharma, Associate Professor, Dept. of Pathology, ACHF, NAU, Navsari.
2.	Forestry	Dr. Sumankumar Jha, Associate Professor, Forest Biology & Tree Improvement, College of Forestry, NAU, Navsari
3.	Agril. Engineering	Dr. Parag Pandit, Assistant Professor, Dept. of Post Harvest Management, ASPEE College of Horticulture, NAU, Navsari
4.	Social Science	Dr. Narendra Singh, Professor, Dept. of Economics, NMCA, NAU, Navsari
5.	Horticulture	Dr. Dev Raj, Convener (Horticulture) & Professor, Post-Harvest Technology, ACoH, NAU, Navsari.
6.	Natural Resource Management	Dr. Sonal Tripathi, Associate Professor, Dept. of Soil Science and Agricultural Chemistry, NAU, Navsari
7.	Crop Improvement	Dr. Bharat K. Davda, Convener (Crop Improvement) & Research Scientist, Main Sorghum Research Station, NAU, Surat
8.	Basic Science	Dr. Rajkumar Katagi, Assistant Research Scientist, Main Cotton Research Station, NAU, Surat

એપેન્ડિક્સ-ડી (પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટી)

Sr. No.	Unit Head (Designation)	Unit Head Name	Committee Designation
1.	Hon. Vice Chancellor	Dr. Z. P. Patel	Chairman
2.	Director of Research & Dean	Dr. T. R. Ahlawat	Member
3.	Director of Extension Education	Dr. N. M. Chauhan	Member
4.	Director of Students Welfare	Dr. R. M. Naik	Member
5.	Registrar	Dr. H. V. Pandya	Member
6.	Comptroller	Shri. Chirag Naik	Member
7	Executive Engineer	Er. P. R. Pandey	Member
8	Dean, Faculty of Agriculture	Dr. R. M. Naik	Member
9	Dean, Faculty of Horticulture	Dr. Alka Singh	Member
10	Dean, College of Forestry, Navsari	Dr. M. B. Tandel	Member <i>Naile</i>

11	Dean, Faculty of ABM	Dr. Ruchira Shukla	Member
12	Dean, Faculty of Agricultural Engineering	Dr. P. K. Shrivastava	Member
13	Librarian	Dr. H. M. Virdia	Member
14	Retd. Principal, ACHF, NAU, Navsari	Dr. B. N. Patel	Non Official Member
15	Retd. Planning Officer, NAU, Navsari	Dr. V. M. Thumar	Non Official Member
16	Surbhi Wafers Pt. Ltd, Navsari	Dr. Lalit Thumar	Non Official Member
17	Retd. Associate Professor, FRS, Gandevi	Dr. C. B. Patel	Non Official Member
18	Principal Scientist & Head, CSSRI, Bharuch	Dr. Anil Chinchmalatpure	Non Official Member
19	Principal, College of Agriculture, Bharuch	Dr. D. D. Patel	Co-opt Member
20	Principal, College of Agriculture, Waghai	Dr. A. P. Patel	Co-opt Member
21	Principal, Aspee Sakilam Biotechnology Institute, Surat	Dr. Sanjay Mohan Jha	Co-opt Member
22	Associate Director of Research, NAU, Navsari	Dr. V. R. Naik	Co-opt Member
23	Associate Director of Research, NAU, Navsari	Dr. Lalit Mahatma	Co-opt Member
24	Planning Officer	Dr. A. R. Lathiya	Member Secretary

મુદ્રા નંબર-૧૦ : તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતા માસિક મહેનતાણા :-

અ.નં.	અધિકારીશ્રીનું નામ/હોદ્દી	પગાર-ધોરણ	ગોસ પે
૧	ડૉ. ટી.આર. અહલાવત, સંશોધન નિયામકશ્રી	૧૩૧૪૦૦-૨૧૭૧૦૦	૨,૪૫,૧૧૨/-
૨	ડૉ. વી. આર. નાયક, સહ સંશોધન નિયામકશ્રી (રેચર્ચ)	૧૩૧૪૦૦-૨૧૭૧૦૦	૨,૨૮,૭૭૯/-
૩	ડૉ. લલિત મહાત્મા, સહ સંશોધન નિયામકશ્રી (એજ્યુકેશન)	૧૩૧૪૦૦-૨૧૭૧૦૦	૨,૫૭,૨૫૪/-
૪	શ્રી અમાતભાઈ લાઠીયા, આયોજન અધિકારી	૫૮૦૦૦-૨૦૫૫૦૦	૧,૨૩,૮૬૨/-
૫	ડૉ. બી.બી. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક પુલના ધોરણે, ખર્ચ : અસ્પી કોલેજ, ન.કૃ.યુ. નવસારી	૫૭૭૦૦-૧૮૨૪૦૦	૧,૧૩,૪૨૦/-
૭	ડૉ. ઇનેશ એચ. ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક પુલના ધોરણે, ખર્ચ : એન.એમ.સી.એ. કોલેજ	૫૭૭૦૦-૧૮૨૪૦૦	૧,૦૦,૬૪૫/-
૮	ડૉ. જી. ડી. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક પુલના ધોરણે, ખર્ચ: અસ્પી કોલેજ, ન.કૃ.યુ. નવસારી	૫૭૭૦૦-૧૮૨૪૦૦	૧,૨૯,૬૫૦/-
૯	ડૉ. એમ.એસ. શાંકનુર, મદદનીશ પ્રાધ્યાપક પુલના ધોરણે, ખર્ચ : અસ્પી કોલેજ	૫૭૭૦૦-૧૮૨૪૦૦	૧,૨૨,૧૮૦/-
૧૦	શ્રી બી.એમ.મોટે, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક	૫૭૭૦૦-૧૮૨૪૦૦	૧,૦૦,૬૪૫/-
૧૧	શ્રીમતી સપના ટી.આર., પી.એસ. ટુ ડી.આર.	૩૪૮૦૦-૧૧૨૪૦૦	૫૪,૫૫૫/-
૧૨	શ્રી પી. વી. લીમ્બાચીયા, ખેતીવાડી અધિકારી	૩૬૬૦૦-૧૨૬૬૦૦	૫૮,૧૪૪/-
૧૩	શ્રીમતી અંજનાબેન એસ. પટેલ, સીનીયર કલાક્ષ	૩૪,૪૦૦-૧,૧૨,૪૦૦	૫૫,૧૪૨/-
૧૪	શ્રીમતી સોનલબેન બી. ગરાસીયા, હેડ કલાક્ષ	૨૫૫૦૦-૮૧૧૦૦	૫૨,૫૩૮/-

Nayak

૧૫	શ્રી મયુર જે. પટેલ, ખેતી મદદનીશ	૨૫૫૦૦-૮૧૧૦૦	૫૧,૬૬૬/-
૧૬	શ્રી. એચ.કે.ચૌધરી, ખેતી અધિકારી પુલના ઘોરણે ખર્ચ : અસ્પી કોલેજ, ન.કૃ.યુ. નવસારી	૩૬૬૦૦-૧૨૬૬૦૦	૫૮,૨૫૪/-
૧૭	કુ. સમતાબેન વી. ખટાડે, ખેતી મદદનીશ	૨૫૫૦૦-૮૧૧૦૦	૩૮,૩૮૮/-
૧૮	શ્રી દિલિપભાઈ એમ.પટેલ, સીનીયર કલાક્ષ	૨૫૫૦૦-૮૧૧૦૦	૪૨૭૩૪/-
૧૯	શ્રી. વિપુલ ટી. પટેલ, પટાવાળા	૧૫૦૦૦-૪૭૬૦૦	૩૦,૬૩૦/-

મુદા નં- ૧૧ : તમામ યોજનાઓ, સુચિત ખર્ચ અને ચુકવેલા નાણા પરના અહેવાલોની વિગતો દર્શાવતી, તેની દરેક એજન્સીને ફાળવેલ અંદાજપત્ર :-

- ભારત/રાજ્ય સરકાર દ્વારા અત્રેની કચેરીને સંશોધન માટે અંદાજપત્ર મંજુર કરી યુનિવર્સિટીના હિસાબી અધિકારી-વ-હિસાબ નિયામકશ્રી મારફત ફાળવવામાં આવે છે. આ ફાળવેલ ગ્રાન્ટ મુજબ નાણાંકીય વર્ષ દરમ્યાન ખર્ચ કરવામાં આવે છે અને વર્ષના અંતે સંયુક્ત વાર્ષિક અહેવાલ હિસાબી અધિકારી-વ-હિસાબ નિયામકશ્રી દ્વારા તૈયાર કરવામાં આવે છે અને સરકારશ્રીમાં રજુ કરવામાં આવે છે.

અત્રેની કચેરી ખાતે કાર્યરત યોજનાઓની માહિતી નીચે મુજબ છે.

અ. નં.	યોજનાનું નામ	બજેટ સંદર	ફાળવેલ રકમ (રૂ. લાખમાં)
પ્લાન યોજના			
૧	સ્ટ્રેન્ધનીંગ ઓફ પ્લાનીંગ, મોનીટરીંગ એન્ડ ઇવેલ્યુએશન સેલ	૧૨૦૬૩	૫૬.૧૦
૨	ઇકોનોમિક એસેસમેન્ટ ઓફ એગ્રીકલ્યર ટેકનોલોજી ઇન સાઉથ ગુજરાત	૧૨૦૬૭	૨૦.૦૦
૩	કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફ ઓન કેમ્પસ	૧૨૭૧૨-૫-બી	૪૮.૫૦
નોન પ્લાન યોજના			
૪	સ્કીમ ફેર સીડ સેલ, નવસારી	૫૦૭૫	૩૨.૭૭
૫	એસોસીએટ ડાયરેક્ટર ઓફ રીસર્ચ, એન.એ.આર.પી., નવસારી	૭૦૮૧-સી	૨૭.૩૧
૬	ડાયરેક્ટર ઓફ રીસર્ચ, નવસારી	૪૫૦૧	૭૪.૩૪
૭	એક્ષપાન્સન ઓફ ડાયરેક્ટર ઓફ રીસર્ચ (ઝોન) ઓફિસ, નવસારી	૪૫.૭૩/૪	૦૭.૫૭

મુદા નં- ૧૨ : ફાળવેલ રકમો સહિત સબસિડી કાર્યક્રમોની અમલ બજવણીની રીત અને એવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો :-

- અત્રેની કચેરીથી કોઈ પણ પ્રકારની આર્થિક સહાય લાભાર્થીઓને આપવામાં આવતી નથી, જેથી લાગુ પડતો નથી.

મુદા નં- ૧૩ : તેણે આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :-

- લાગુ પડતો નથી.

મુદા નં- ૧૪ : ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેની પાસેની માહિતીને લગતી વિગતો :-

- નવસારી કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.nau.in પર જરૂરી તમામ માહિતી ઉપલબ્ધ છે.

Nyale

સહ સંશોધન નિયામક(રીસર્ચ)

મુદા નં- ૧૫ : જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય, તો તેવા ગ્રંથાલય અથવા તેના વાંચન કક્ષના કામકાજના કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :-

- લાગુ પડતું નથી.

મુદા નં- ૧૬ : જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો :-

ડૉ. વી. આર. નાયક, સહ સંશોધન નિયામકશી (કૃષિ), સંશોધન નિયામકશીની કચેરી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી		
ટેલીફોન નંબર		
ઓફિસ	:	૦૨૯૩૭ ૨૮૩૪૫૨
મોબાઇલ	:	૯૯૭૯૮૪૮૨૮૭૧
રહેઠાણ	:	૯૯૭૯૮૪૮૨૮૭૧
ફેક્સ	:	૦૨૯૩૭ ૨૮૩૪૫૨
E-mail	:	<u>adr_agri@nau.in</u>

પ્રો. અમીતભાઈ લાઠીયા, આયોજન અધિકારી,
સંશોધન નિયામકશીની કચેરી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી

ટેલીફોન નંબર

ઓફિસ	:	૦૨૯૩૭ ૨૮૩૪૫૨
મોબાઇલ	:	૯૯૭૯૮૪૨૭૪૨૬
રહેઠાણ	:	૯૯૭૯૮૪૨૭૪૨૬
ફેક્સ	:	૦૨૯૩૭ ૨૮૩૪૫૨
E-mail	:	<u>po@nau.in</u>

મુદા નં- ૧૭ : ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી ; પ્રસિધ્ય કરવી જોઈશે અને ત્યારપણી દર વર્ષે આ પ્રકાશનોને અધ્યાવત કરવા જોઈશે :-

- હા, આ માહિતી મે-૨૦૨૪ માં અધ્યતન કરવામાં આવશે.

સહ સંશોધન નિયામક(રીસર્ચ)